

નોવેલ કોરોના વાઇરસ (Covid-19)ના  
સંકમણાને નિયંત્રણામાં લાવવા લેવાના થતાં  
નિવારાત્મક પગલાંઓ બાબત.

ગુજરાત સરકાર  
સામાન્ય વહીવટ વિભાગ  
પરિપત્ર ક્રમાંક: પરચ-૧૦૨૦૨૦-૫૦૧-૨  
સચિવાલય, ગાંધીનગર.  
તા.૦૫/૦૬/૨૦૨૧

વંચાએ લીધા : આ વિભાગનો સમાન ક્રમાંકનો તા.૨૮/૦૫/૨૦૨૧નો પરિપત્ર.

### **પરિપત્ર:**


રાજ્યમાં કોરોના વાઇરસ (કોવિડ-૧૯)નું સંકમણ વધતા તમામ સરકારી / અર્દ્ધસરકારી / બોર્ડ / કોપોરેશનની કચેરીઓમાં ફરજ બજાવતાં અધિકારીઓ / કર્મચારીઓને નોવેલ કોરોના વાઇરસ (Covid-19) ચેપી રોગનું સંકમણ ન થાય તે માટે પૂર્તી તકેદારી લેવાના ભાગને ઉપર વંચાણમાં લીધેલ પરિપત્રથી જરૂરી સૂચનાઓ તા.૩૧/૦૫/૨૦૨૧ થી તા.૦૪/૦૬/૨૦૨૧ સુધીના સમયગાળા માટે પરિપત્રિત કરવામાં આવેલ છે.

**૨.** કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ તા.૦૭/૦૬/૨૦૨૧ થી સરકારી / અર્દ્ધસરકારી કચેરી, બોર્ડ / કોપોરેશન ૧૦૦% કર્મચારીઓની હાજરી સાથે રાખેતા મુજબ કાર્યરત કરવાનું સુનિશ્ચિત કરવા નક્કી કરેલ છે.

**૩.** રાજ્ય સરકાર દ્વારા નોવેલ કોરોના વાઇરસ (Covid-19)ના સંકમણાને નિયંત્રણામાં રાખી શકાય તે હેતુથી જાહેર કરવામાં આવેલ વખતોવખતની ઘોરણાસરની કાર્યપદ્ધતિ / માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા તેમજ જાહેર હિતમાં નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવે છે.

- કચેરીમાં કર્મચારીઓ / અધિકારીઓની હાજરીના સંબંધમાં દરેક કામના સ્થળે સામાજિક અંતર (Social Distances) જળવાય તે જોવાનું રહેશે.
- નોવેલ કોરોના વાઇરસ (Covid-19)નું સંકમણ ન થાય તે અંગે બેઠક માટે વીડીયો કોન્ફરન્સ સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ થાય તે પ્રકારનું આયોજન કરવા સર્વે વહીવટી વિભાગને જણાવવામાં આવે છે.
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતોવખત Covid-19 અંગે બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું અમલ કરવાનું રહેશે.

ગુજરાતના રાજ્યપાત્રશીના હુકમથી અને તેમના નામે,

  
( કમલ દયાની )

અધિક મુખ્ય સચિવ (ક.ગ.)  
સામાન્ય વહીવટ વિભાગ  
ગુજરાત સરકાર

પ્રતિ,

- (૧) માન. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી, રાજ્યભવન, ગાંધીનગર.
- (૨) માન. મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર.
- (૩) માન. મંત્રીશ્રી/રા.ક.મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ, સ્વર્ણિમ સંકુલ-૧/૨, ગાંધીનગર.
- (૪) માન. વિરોધપક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી, ગુજરાત વિદ્યાનસભા, સચિવાલય, ગાંધીનગર.
- (૫) મુખ્ય સચિવશ્રીના સંયુક્ત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
- (૬) સર્વે અધિક મુખ્ય સચિવશ્રી / અગ્ર સચિવશ્રી / સચિવશ્રી, સચિવાલયના સર્વે વિભાગ (તેઓ છસ્તકના ખાતાના વડા તેમજ તાબાની કચેરીઓના દ્યાને મુકવા સારુ.)
- (૭) નિવાસી નાયબ સચિવશ્રી, સા.વ.વિ., સચિવાલય, ગાંધીનગર.
- (૮) નાયબ પોલીસ અધીક્ષકશ્રી (સલામતી શાખા), સચિવાલય, ગાંધીનગર.
- (૯) સામાન્ય વહીવટ વિભાગના સર્વે અધિકારીશ્રી.
- (૧૦) સેક્શન અધિકારીશ્રી (બુથ), સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- (૧૧) સેક્શન અધિકારીશ્રી (HRMS Cell), સા.વ.વિ., સચિવાલય, ગાંધીનગર.
- (૧૨) સિલેક્ટ ફાઇલ (૨-શાખા)
- (૧૩) જનરલ સિલેક્ટ ફાઇલ.